

July 11, 2024

To,

BSE Limited National Stock Exchange of India Limited

25, P. J. Towers, Exchange Plaza, C-1, Block G,
Dalal Street, Bandra — Kurla Complex, Bandra (E)
Mumbai — 400 001 Mumbai — 400 051

Scrip Code: 500120 Symbol: DIAMINESQ

Sub. Publication of Revised Notice for the 48th Annual General Meeting, E-voting information and Book Closure in newspaper

Dear Sir,

Pursuant to Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclosed herewith copies of Revised Notice published in Business Standard (English newspaper) and Vadodara Samachar (Gujarati newspaper) regarding the Re-scheduled 48th Annual General Meeting, E-voting information and Book Closure of the Company.

Kindly take the same on record.

Thanking You.

Yours Faithfully, For Diamines and Chemicals Limited

Hemaxi Pawar Company Secretary Membership No. A52581

ENCL: As above

DEMAND NOTICE

The under mentioned account became N.P.A. and demand notice issued by the Bank to the Borrower under Section 13(2) of Securitisation 8 onstruction of Financial Assets and Enforcement of Security Interest Act (The Act) 2002 & Sent by Regd. Post, was returned unserved with

remarks " Lett " to the below mention	nea Borrower.		
Name of the Borrower & Gaurantor	Date of Demand Notice	Nature of Facility	Details of Secured Asset
Mr. Ajaykumar Jaikishanprasad	16.04.2024	Home Loan	Equitable Mortgage of Flat No. A-602, 6th Floor, Block-A, Sai
Gupta (Mortgagor & Borrower)	Date of NPA	Sanctioned Limit	Green Valley-1, Nr. Vibhusha Bunglows, on Land bearing
& Mrs. Lalitadevi Ajaykumar	14.04.2024	Rs. 18,23,000/-	Block No. 72 (Old S No. 58/1, 92/3), TPS No. 2, FP No. 24,
Gupta (Co-Mortgagor & Co-		Outstanding Dues	Village Mouje: Ghuma, Taluka Dascroi, District: Ahmedabad
Borrower) Address: Flat No. A-		Rs. 17,18,388.47	-380058
602, 6th Floor, Block-A, Sai Green		as on 16.04.2024	
Valley-1, Nr. Vibhusha Bunglows,			
Ghuma, Ahmedabad - 380058			

Borrower/Guarntors are hereby informed that Authorised Officer of the Bank shall under provision of SARFAESI Act, take Possession and Subsequently auction the Mortgaged Property, Secured assets as mentioned above if the Borrower do not pay the amount as mentioned above within 60 days from the date of publication of this notice. The Borrower/Guarntors are also prohibited under section 13(13) of SARFAESI Act to transfer by sale, lease or otherwise the said secured assets stated above without obtaining written consent of the Bank. This public notice is to be treated as notice

u/s 13(2) of the SARFAESI Act, 2002. The said Notice is pasted at the property on 13.05.2024.

Borrower/Guarntors is advised to collect the original notice issued under Section 13 (2) from the undersigned on any working day by discharging valid receipt. The borrower's attention is invited to the provisions of Sub-section (8) of Section 13 of the SARFAESI Act, in respect of time available, to redeem the secured assets.

Date: 11.07.2024. Place: Ahmedahad Sd/- Authorised Officer, Bank of India

STATE BANK OF INDIA

Stressed Assets Recovery Branch, 2nd Floor, Samyak Status, Opp. D.R. Amin School, Diwalipura Main Road, Vadodara-390007

PUBLICATION OF NOTICE REGARDING POSSESSION OF PROPERTY U/S 13(4) OF SAFAESI ACT 2002

Notice is hereby given under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under section 13 (12) read with Rule 9 of the Security Interest (Enforcement) Rules, 2002, a demand notice was issued on the dates mentioned against each account and stated hereinafter calling upon them to repay the amount within 60 days from the date of receipt of said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of power conferred on him/her under section 13(4) of the said Act read with Rule 9 of the said Act on the dates mentioned against each account.

The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the **STATE BANK OF INDIA** for an amount and interest thereon.

The borrowers attention is invited to provisions of Sub-section(8) of Section 13 of the Act, in respect of time

available to redeem the	secured assets.				
Name of Account / Borrower & address	Name of Proprietor/ Partners/Guarantors/ Owner of property etc.	Description of the property mortgaged / charged	Date of Demand Notice	Date & Type of Possession	Amount Outstanding
Shri Suresh Shantilal Panchal (Borrower, since deceased): through legal heirs Smt. Shobhaben Sureshbhai Panchal (wife), Smt. Mivika Sureshbhai Panchal (daughter), Smt. Shweta Sureshbhai Panchal (daughter), Smt. Smita Sureshbhai Panchal (daughter), and Shri Swastikkumar Sureshbhai Panchal (son) & Smt. Shobhaben Sureshbhai Panchal (Co-Borrower)	Shantilal Panchal & Smt. Shobhaben Sureshbhai Panchal, Guarantor (Home Loan): Shri Vinodbhai Gautamsing	All that part and parcel of immovable property located at Surat District, Sub District: Surat City, Moje Village Udhna, R.S. No. 218/1, T. P. Scheme No. 2 (Udhna), Final Plot No. 24, in the project known as 'Shivbhakti Park' on westem side of land admeasuring' 2943.00 sq. mtrs at House No. 6, having Plot Area 51.67 sq. mtrs, and Margin land of 43.08 sq. mtrs otal Area 94.75 sq. mtrs and property comprises ground floor and first floor having total construction area of approx. 78 sq. mtrs with all its internal and external encumbrances. (Property owned by Suresh Shantilal Panchal). The property is bounded as follows: East: House No. 22 and 23, West: Society Road, North: Adjacent Survey Number, South: House No. 8	20.03.2024	10.07.2024 (Symbolic Possession)	Rs.31,23,052.19 (Rupees Thirty One Lakh Twenty Three Thousand Fifty Two and Paise Nineteen only) as on 19.03.2024 less recovery thereafter together with further interest at the contractual rate on aforesaid amount together with incidental expenses, costs and charges thereon.

Diamines

DIAMINES AND CHEMICALS LIMITED

CIN NO: L24110GJ1976PLC002905

Registered Office: Plot No. 13, PCC Area, P.O. Petrochemicals, Dist. Vadodara - 391350

REVISED NOTICE OF 48™ ANNUAL GENERAL MEETING, E-VOTING INFORMATION & BOOK CLOSURE

Revised Notice is hereby given that the 48th Annual General Meeting (AGM) of Diamines and Chemicals Limited ("the Company") is rescheduled and will be held at Registered office of the company situated at Plot No.13 PCC Area, P. O. Petrochemicals, Vadodara - 391350, on **Thursday, August 01, 2024 at 11:00 AM,** to transact Ordinary as well as Special businesses as set out in the revised notice of AGM dated July 09, 2024 ("Notice") The said notice along with proxy form, Attendance slip, e-voting communication and Annual report together with Audited Financial statements (Standalone & Consolidated) have been dispatched to all the members on June 29, 2024, at their registered address by Courier / Post and electronically to those members, who have their e-mail addresses registered with the Company / Depository Participant(s). The aforesaid revised notice along with, other documents are available on website of the company at www.dacl.co.in and also available on the website of Link Intime India Private Limited at https://instavote.linkintime.co.in. The dispatch of revised notice of 48th AGM for the financial year 2023-24 has been completed on July 10, 2024.

As per Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is providing remote e-voting facility to its members to cast their vote by electronic means on all Resolutions set out in the Notice of AGM i.e. from a place other than venue of AGM, through e-voting services provided by Link Intime India Private Limited ("LIIPL") on all the resolutions set forth in the revised Notice of 48th AGM. Members holding shares either in physical form or in dematerialized form, as on cut-off date of July 25, 2024, may cast their votes electronically on all the resolutions set forth in the Notice of 48th AGM.

All the members are hereby informed that:

- **REMOTE E-VOTING:**
- It may please be noted that the Ordinary and Special Business as set out in the Notice of AGM will also be transacted by electronic means through remote e-voting service provided by LIIPL.
- Members are requested to refer Notes forming part of notice of AGM dtd. July 09, 2024, regarding process and manner of remote E-voting.
- The cut-off date for the determining the eligibility to vote by remote e-voting at the AGM is July 25, 2024.
- The remote e-voting shall commence on Sunday, July 28, 2024 (from 9:00 a.m. IST) and shall end on Wednesday, July 31, 2024 (5:00 p.m. IST). During this period, members may cast their vote electronically. The e-voting module shall be disabled by LIIPL thereafter. The voting rights of members shall be in proportion to the equity shares held by them as on July 25, 2024 ("Cut-off date"). Any person who is a member of the company on the Cut-off date is eligible to cast vote on all resolutions set forth in the
- The facility of voting through poll will be provided at the AGM. The Members attending the meeting and those who have not cast their vote earlier by e-voting shall be able to vote at the meeting.
- A member may participate in the AGM even after exercising his right to vote through remote e-voting but shall not be allowed to vote again in the meeting.
- A member who is entitled to attend and vote in the meeting is also entitled to appoint a proxy to attend and vote instead of himself and a proxy need not be a member. The instrument appointing proxy should, however, be deposited with Registered office of the Company not less than Forty Eight hours before the Commencement of the Meeting.
- Any person, who acquires shares of the Company and becomes member of the company after dispatch of the Notice of the AGM and holding shares as on the cut-off date i.e., July 25, 2024 may obtain login id and password by sending a request at enotices@linkintime.co.in. However if a person is already registered with LIIPL for e-voting then existing user id and password can be used for casting vote.
- In case the shareholders have any queries or issues regarding e-voting, you may contact Link Intime INSTAVOTE helpdesk by sending a request at enotices@linkintime.co.in or contact on : Tel: 022 4918 6000. Members may also write to the Company Secretary of the Company at secretarial@dacl.co.in or at the Registered Office of the Company.

BOOK CLOSURE:

Place: Vadodara

Date: July 10, 2024

- Notice is also hereby given pursuant to Section 91 of the Companies Act, 2013 and Regulation 42 of SEBI (Listing Obligations and Disclosure Requirements), Regulations, 2015, the Register of Members & Share Transfer Books of the Company will remain closed from July 26, 2024 to August 01, 2024 (both days inclusive) for the purpose of 48th AGM and payment of Final Dividend (if approved by the Members at
- The members are requested to communicate all their correspondence to the Registrars & Share Transfer Agent M/s Link Intime India Pvt. Ltd. at "Geetakunj" 1, Bhaktinagar Society, Behind ABS Towers, Old Padra Road, Vadodara 390015 with Contact person Mr. Alpesh Gandhi at Email: vadodara@linkintime.co.in and Ph. No. 0265-3566768.

Pursuant to Finance Act 2020, dividend income is taxable in the hands of shareholders w.e.f. April 1, 2020 and the Company is required to deduct tax at source from dividend paid to shareholders at the prescribed rates, if approved by the Shareholders in 48th AGM. For the prescribed rates for various categories, the shareholders are requested to refer to the Finance Act, 2020 and amendments thereof. The shareholders are requested to update their PAN with the Company's Registrar and Transfer Agent (in case of shares held in physical mode) and with relevant depository participant (in case of shares held in demat mode) on or before July 15, 2024. In case their PAN is not registered, the tax will be deducted at a higher rate of 20%. A Resident individual shareholder with PAN and who is not liable to pay income tax can submit a yearly declaration in Form No. 15G/ 15H, to avail the benefit of non-deduction of tax at source and Non-resident shareholders can avail beneficia rates under tax treaty between India and their country of residence, subject to providing necessary documents i.e. No Permanent Establishment and Beneficial Ownership Declaration. Tax Residency Certificate, Form 10F any other document which may be required to avail the tax treaty benefits, the details are available on website of the Company www.dacl.co.in and RTA www.linkintime.co.in.

By Order of the Board For Diamines And Chemicals Limited Hemaxi Pawar **Company Secretary** Membership No. A52581

Date: 11/07/2024

PUBLIC NOTICE

LINDE INDIA LIMITED, Regd. Office: Oxygen House, P-43, Taratala Road, Kolkata -700 088 Notice is hereby Given that the Certificated for the under mentioned securities of the company have been

lost and the holder of the said securities has applied to the company to issue duplicate certificate. any person who has a claim in respect of the said securities should lodge such claim with company at its Registered Office within 15 days from the date of else the company will proceed to issue duplicate certificat without further intimation

Name of the Holder	Folio/	Certificate	Distinctive	No of	status
& Joint Holder	Client ID No	Nos.	No.	Securities	
KHARE ASHWIN	2235710	188444	110801875 To 11801962	88	current holding
VASNATBHAI	2235710	335593	28791396 To 28791445	50	current holding
AND	2235710	335594	28791446 To 28791455	10	current holding
JT 1 :	2235710	335595	28791456 To 28791465	10	current holding
KHARE VASANTBHAI	2235710	335596	28791466 To 28791475	10	current holding
VANKAPPA	2235710	335597	28791476 To 28791476	1	current holding
	2235710	335598	28791477 To 28791477	1	current holding
	2235710	335599	28791478 To 28791478	1	current holding

Ahmedabad Dated: 08/07/2024 KHARE ASHWIN VASNATBHAI & JT 1 : KHARE VASANTBHAI VANKAPPA (Name of Applicant and Joint Applicant)

PUBLIC NOTICE

PICICIBANK | Branch Office: ICICI Bank Ltd., Office Number 201-B, 2nd Floor, Road No. 1 Plot No-B3, WIFI IT Park, Wagle Industrial Estate, Thane, Maharashtra-400604

The following borrower(s) has/have defaulted in the repayment of principal and interest towards the Loan facility(ies) availed from ICICI Bank. The Loan(s) has/have been classified as Non-Performing Asset(s) (NPA). A Notice was issued to them under Section 13(2) of the Securitisation and Re-construction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, at their last known addresses. However, it has not been served and are therefore being notified by warvof this Public Notice

beei	n served and are therefore beir	ig notified by way of this Public Notice.		
	Name of the Borrower/ Co-Borrower/Guarantor/ (Loan Account Number) & Address	Description of Secured Asset to be enforced	Date of Notice sent/ Outstanding as on Date of Notice	NPA Date
	M/s. Chirag Fashion/ Mr. Mohsin Salimbhai Mulani/ Mr. Tohsif Salimbhai Mulani/ 777705030003/ Block No. M-1, Sumel-10, M. H. Mill Compound, Saraspur, Gujarat Ahmedabad - 380018	Commercial Corporate House Bearing No. M-1 As Per on Site Numbering (Unit No House-1, Block No. M As Per Approved Plan By Amc), in The Building Known As Sumel-10, Phase-1, Situated on The N. A. Land Bearing City Survey No. 255, 256 & 257, Ward No. 02, Final Plot No. 104/1 Paiki, Town Planning Scheme No. 16 (old Survey No. 138/a/1, 139, 142/1, 143, 144/1 and 145), Situated At Moje Shaher Kotda, Taluka Maninagar (old Taluka Ahmedabad City -East), in The Registration Sub-District Ahmedabad -7 (Odhav), Registration District Ahmedabad, Gujarat	June 22, 2024 Rs. 1,38,31,056/-	30-04- 2024

These steps are being taken for substituted service of Notice. The above borrower/s and/or guarantor/s (as applicable) is/are advised to make the outstanding payment within 60 days from the date of publishing this Notice. Else, further steps will be taken as per the provisions of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002.

Sincerely, Authorised Signatory For ICICI Bank Ltd.

ISANPUR Branch: Shop No. 4/5/6, Ground Floor, Kansas DEMAND बैंक ऑफ़ इंडिया BOI Bank of India BOI 382443, Tel. No. 079-25830223. NOTICE Email: isanpur.ahmedabad@bankofindia.co.ir

The under mentioned account became N.P.A. and demand notice issued by the Bank to the Borrower under Section 13(2) of Securitisation 8 Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act (The Act) 2002 & Sent by Regd. Post. was returned unserved with remarks "Left" to the below mentioned Borrower

Name of the Borrower & Gaurantor	Date of Demand Notice	Nature of Facility	Details of Secured Asset
Mr. Rajendra Maganlal	21.05.2024	Star Home Loan	All that piece and parcel of the immovable property on non-
Makwana	Date of NPA	Star Personal Loan	agricultural land being Flat No. E- 302(Block E, Flat No302)
Address: E-302, 3rd Floor,	29.04.2024	Sanctioned Limit	on 3RD Floor admeasuring about 65.21 square meters i.e.
Swami Narayan Park-6, Vatva -		Rs. 8,25,000/-	78.00 square yards super built up area in the scheme known
Ahmedabad, Gujarat, India -			as Swaminarayaran Park-6, situated, lying and being at
380011			mouje-vatva, R.S No-583/3,583/6,583/7, T.P.S No80, Final
			Plot No-29,31 in the district of Ahmedabad and registrar sub
		(Plus Interest	district of Ahemdabad-11(Aslali), State-Gujarat (belonging
		thereon minus	to Mr Rajendra Maganlal Makwana) and the same is
		deposits if any)	bounded form the four sides as follow: East: Flat No. E-301,
			West: Flat No.E-303, North: Flat No.E-305, South: Block B.
D (0 ()	1.6 1.4 . 4 .		THE THE STATE OF T

Borrower/Guarntors are hereby informed that Authorised Officer of the Bank shall under provision of SARFAESI Act, take Possession and subsequently auction the Mortgaged Property / Secured assets as mentioned above if the Borrower do not pay the amount as mentioned above within 60 days from the date of publication of this notice. The Borrower/Guarntors are also prohibited under section 13(13) of SARFAESI Act to transfer by sale lease or otherwise the said secured assets stated above without obtaining written consent of the Bank. This public notice is to be treated as notic u/s 13(2) of the SARFAESI Act, 2002. The said Notice is pasted at the property on 08.07.2024.

Borrower/Guarntors is advised to collect the original notice issued under Section 13 (2) from the undersigned on any working day by discharging valid receipt. The borrower's attention is invited to the provisions of Sub-section (8) of Section 13 of the SARFAESI Act, in respect of Date: 11.07.2024, Place: Ahmedabad

Sd/- Authorised Officer, Bank of India

Chola Enter a better life

CHOLAMANDALAM INVESTMENT AND FINANCE COMPANY LIMITED Corporate Office: "Chola Crest" C-54 & 55, Super B-4, Thiru Vi Ka Industrial Estate, Guindy, Chennai- 600032
Branch Office: 406 to 410, 4th Floor, The One World, Opp, Synergy Hospital, Near Ayodhya Chowk, 150 Feet Ring Roar
Rajkot - 360005 Contact No: Mr. Nitin Panchal -9825438897 Pritesh Oza - 9824456664 / Premal Bhatt - 9376152588 SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES

E-auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement o Security Interest (Enforcement) Rules, 2002.

Security interest Act, 2002. A with proviso to rule & & of the Security interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower / Co-Borrower / Mortgagor (s) that the below described immovable properties mortgaged to the Secured Creditor, the PHYSICAL POSSESSION of which has been taken by the Authorised Officer of Cholamandalam investment and Finance Company Limited the same shall be referred herein after as Cholamandalam investment and Finance Company Limited. The Secured Assets will be sold on "As is where is", "As is what is" and "Whatever there is" basis through E-Auction. It is hereby informed to General public that we are going to conduct public E-Auction through website https://www.auctionfocus.in/chola-lap.

A/C No. & Name of Borrower, Co-borrower, Mortgagors	Date & Amount as per Demand Notice u/s 13(2)	Descriptions of the property/Properties	Reserve Price, EMD & Bid Inc. Amount (In Rs.)	
(Loan A/C No. HE01JUN0000018355) 1. Kiritbhai Vithalbhai Thakrar 2. Kajalben Kiritbhai Thakrar 3. Chandulal Vithal Thakrar 4. Kirtiben Thakrar 5. Jalaram Traders Add.: 18 Pitru Krupa, Giriraj Society 3, B/h Bus Stand, Mangnath Road, Junagadh-362001 & Main Chowk, At. Lushala, Tal. Vanthli, Dist: Junagadh Gujarat 362215	15/11/2023 & Rs.29,87,887/- as on 08-11-2023 Total Outstanding Rs. 32,11,219/- as on 01-07-2024	A Residential House Block No.18 Constructed on Land Sq. Mtrs. 93-50 Of N.A. R.S. No.114/1 Paiki (C.S. Sheet No.31, C.S. No.417) Situated Within Limits of Junagadh Municipal Corporation Tal. & DistJunagadh, Pin362001. Boundaries Of Property: East: Adj. Road, West: Adj. Property Of Others, North: Adj. Land Of Block No.3/17, South: Adj. Land Of Block No.3/145.	Rs.35,25,000/- Rs. 3,52,500/- Rs. 25,000/-	30.07.2024 at 11:00 am to 1:00 PM (with unlimited extension of 3 min each), 29.07.2024 (up to 5.30.P.M) 20.07.2024 (11.00 A.M to 1.00 P.M)
(Loan A/C No. HE01JUN0000029671) 1.Rajeshkumar Manharlal Liya, 2. Shri Rajesh Television Keshod, 3. Karan Rajeshbhai Liya, 4. Dharmishthaben Rajeshbhai Liya, 4. Dharmishthaben Rajeshbhai Liya. All are having address for communication at: Block No 104, Sarvoday Society, Airport Road, Keshod, Junagadh — 362220 Also At, Shop No 2, Sundar Complex, Opp Girls School, Keshod, Junagadh Gujarat 362220	17/01/2024 & Rs. 60,30,767.00 /- as on 08-01-2024 Total outstanding Rs. 63,43,736 /- as on date 21-06-2024	A Residential House constructed on land admeasuring sq. mtrs. 507-19 of block no.104 of "Shri Sarvoday Co.Op.Ha.So.Ltd. Keshod" of Plot No.41 to 48, 102 to 105, 109 to 114 of s. no.754/ paiki 26 situated at Keshod, Tal-Keshod, DistJunagadh, Pin-362220. Bounded as under: East: Adj. Block No. 107, West: Adj. Road, North: Adj. Block No. 103, South: Adj. Block No. 105.	Rs. 60,00,000/- Rs. 6,00,000/- Rs. 50,000/-	30.07.2024 at 11:00 am to 1:00 PM (with unlimited extension of 3 min each), 29.07.2024 (up to 5.30.P.M) 19.07.2024 (11.00 A.M to 1.00 P.M)

1. All Interested participants / bidders are requested to visit the website https://w.ww.auctionfocus.in/chola-lap & https://cholamandalam.com/news/auction-notices. For details, help, procedure and online training on e-auction, prospective bilders may M/s. Auction Focus Private Limited; Contact Prachi Trivedi Contact number: 9016641848. email id: support@auctionfocus.in

For further details on terms and conditions please visit https://w.ww.auctionfocus.in/chola-lap & https://chola notices to take part in e-auction.

This is also a Statutory 15 Days Sale Notice Under Rule 8 & 9 of Security Interest (Enforcement) Rules, 2002

POSSESSION NOTICE (for immovable property)

(as per Appendix IV read with Rule 8(1) of the Security Interest (Enforcement) Rules,2002)

EDELWEISS ASSET RECONSTRUCTION COMPANY LIMITED Retail Central & Regd. Office: Edelweiss House, Off CST Road, Kalina, Mumbai 40009

Whereas, That the Original Lenders have assigned the below financial assets to Edelweiss Asset Reconstruction Company Limited which is acting in its capacity as various trustees mentioned below (EARC). Pursuant to the assignment agreer under Sec.5 of SARFAESI Act. 2002. EARC has stepped into the shoes of the Assignor and all the rights, title and interests o Assignor with respect to the financial assets along with underlying security interests, guarantees, pledges have vested in FARC in respect of the financial assistance availed by the Borrowers and **EARC** exercises all its rights as a secured creditor.

The Authorized Officer of the EARC, under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Act), 2002 and in exercise of powers conferred under Section 13(12) read with (Rule 3) of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice as mentioned below calling upon the borrower(s) to repay the amounts nentioned in the notice within 60 days from-the date of receipt of the said notice.

The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrowers and the public in general that th undersigned being the Authorised Officer of Edelweiss Asset Reconstruction Company Limited has taken Physical Possession of the properties described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13

of Act read with rule 8 of the Security Interest Enforcement) Rules, 2002 on the date mentioned against each property The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redee the secured assets. The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Edelweiss Asset Reconstruction Company Limited for the amour nentioned below and interest thereon.

Name of Assignor	Name of Trust	Loan A/c Number	Borrower Name & Co-Borrower (s) Name	Amount & Date of Demand Notice	Date of Possession	Possession Status
M/s. Cholamandalam Investments & Finance Company Limited	EARC Trust SC- 481	XUHLSI	1) Mr. Suresh Ram Chandra (Borrower), 2) Mr. Madan Kanwar Nem Singh, 3) Mr. Nem Deep Singh (Co-borrower)	Rs. 15,25,663.08/- (Rupees Fifteen Lacs Twenty Five Thousand Six Hundred Sixty Three And Eight Paisa Only) as on 08-12-2023 & 11-12-2023	05-07-2024	Physical Possession

Description of Secured Asset - All That Piece and Parcel of Property Bearing Plot No. 182, Sardar Row House, Opp. Gajera ichool, Nr. Sachin GIDC Gate No. 4, Talangpur Road, Pali Sachin, Surat 394230 and said Property Situated at Plot No. 182 Adm 11.6 X 42 Sq. Fts. I. E. 53.66 Sq. Yard I. E. 44.87 Sq. Mts. in "Sardar Nagar Row House " Situated At R. S. No. 19/2, Block No. 23 OI

Piramal Capital & Housing Finance Limited		1800007 403	1) Mr. Brejesh Surendra Dubey (Borrower), (2) Mr. Mithilesh Surendra Dubey (Co-borrower)	Rs. 21,86,178.42 <i>i</i> - (Rupees Twenty One Lakh Eighty Six Thousand One Hundred Seventy Eight And Forty Two Paisa Only) as on 30-10-2023 & 02-11-2023	06-07-2024	Physical Possession							
Description of S	ecured As	set - All	That Piece And Parcel of Immovab	le Property Bearing Plot No.	Description of Secured Asset - All That Piece And Parcel of Immovable Property Bearing Plot No. 50 Sahyog Residency								

osamadi Ankleshwar Bharuch 393001 and Property Situated at Plot No. 50 in Sahyog Residency B/H Domino's Kapodara Patiya & Beside Man Mandir Residency Moje: Kosamadi, Ta: Ankleshwar, Dis: Bharuch.

♠ Edelweiss

Authorised Office

Date: 11/07/2024

Edelweiss Asset Reconstruction Company Limited

पंजाब नैशनल बैंक

punjab national bank

Circle SASTRA Centre Surat 1st Floor, Meghani Tower, Station Road, Surat, 395003 Ph.: 0261-2454543 email: cs8323@pnb.co.ir
Appendix-IV[See Rule 8(1)]POSSESSION NOTICE (For immovable Property)

Whereas. The undersigned being the Authorised Officer of Puniab National Bank, Circle SASTRA Surat under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued demand notice dated 19/06/2023 under section 13(2) of the said Act calling upon the Borrower Mr. Radheshyam Ramprasad Sahu to repay the amount mentioned in the notice being ₹ 12,11,857.40 (Rupees Twelve Lac Eleven Thousand Eight Hundred Fifty Seven & Paisa Forty only) as on 31/05/2023 with further interest at the contracted rate and cost expenses etc.. within 60 days from the date of the receipt of the said notice.

The borrowers/Guarantors/Mortgagors having failed to repay the amount, notice is hereby given to the borrowers and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of power conferred on her under section 13(4) of the said Act read with Rule 8 of the said Rules on 8th July of the year 2024. The borrowers/Guarantors/Mortgagor in particular, and the public in general is hereby

cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Puniab National Bank for an amount of ₹ 12.11.857.40 (Rupees Twelve Lac Eleven Thousand Eight Hundred Fifty Seven & Paisa Forty only) as on 31/05/2023 with further interest at the contracted rate and cost expenses etc., until payment in full.
The borrowers' attention is invited to provision of Sub Section (8) of the Section 13 of the Act

in respect of time available to redeem the secured assets. Description of the Immovable Property

All The Piece and Parcel of the immovable Property being Residential Flat No.204. admeasuring about 69.70 Square Meters, super built-up area lying and located on the Second Floor of the building known as "PARIVAR APARTMENT", along with undivided share admeasuring about 10.00 Square Meters, constructed on N.A. land bearing Survey No. 471/A/P7, admeasuring about 2926.00 Square Meters, Situated at Village: Dungra, Taluka Vapi, Dist: Valsad, Gujarat State owned by Mr. Radheshyam Ramprasad Sahu. Bounded North: Flat No. 203, South: Flat No. 205, East: Open Space, West: Passage.

Date: 08/07/2024 | Place: Vapi

Authorised Officer, Punjab National Bank



HeroHousing

Branch Office: Office No. 309, Third Floor, Nishal Centre, Near Nishal Circle, Pal Road, Pal Adaian, Surat - 395009

PUBLIC NOTICE (E - AUCTION) FOR SALE OF IMMOVABLE PROPERTY [UNDER RULE 8(6) OF THE SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002] NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTY MORTGAGED WITH HERO HOUSING FINANCE IMITED(SECURED CREDITOR) UNDER THE SECURITISATION AND RECONSTRUCTION OF INANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002.

FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002.

Notice is hereby given to the public in general and in particular to the borrower(s) and guarantor(s) or their legal heirs/ representatives that the below described immovable properties mortgaged/charged to the Secured Creditor, the possession of which has been taken by the Authorized Officer of Hero Housing Finance Limited (secured creditor), will be sold on 30-Jul-2024 (E-Auction Date) on "AS IS WHERE S", "AS IS WHAT IS" and "WHATEVERT THERE IS" basis for recovery of outstanding dues from below mentioned Borrowers, Co- Borrowers or Guarantors. The Reserve Price and the Earnest Money Deposit is mentioned below. The EMD should be made through Demand Draft/RTGS/NEFT for participating in the Public E-Auction along with the Bid Form which shall be submitted to the Authorised Officer the Hero Housing Finance Ltd On or before 29-Jul-2024 till 5 PM at Branch Office: 309,Third Floor, Nishal Centre, Near Nishal Circle, Pal Road, Pal, Adajan, Surat-395009.

,	,	,,			
Loan Account No.	Name of the Borrower(s)/ Co-Borrower(s)/ Guarantor(s)/ Legal Heir/Legal Rep	Date of Demand Notice/ Amount as on date	Type of Possession (Under Constructive/ Physical)	Reserve Price	Earnest Money
19000002432,	Saminbanu Mohd. Ajij Shaikh, Shaikh Mohmad Ajij Mohmad Salim, Mohammad Salim P Shaikh	30/11/2021 Rs. 24,45,875/- as on 08/07/2024	(Physical)	Rs. 11,20,000/-	Rs. 1,12,000/-

Description of property: All the piece and parcel of Residential Flat/Apartment Bearing Flat No-B/101 B-Wing, Situated at First Floor at Aalishan Heights, Plot No. 8 To 12 & 33 to 37, Survey No. 489/2 Paik City Survey No-6447 Paiki Surati Park, Bardoli, Surat, Gujrat-394601. Area Admeasuring Construction area 63.18 Sq. Mtr., with common amenities written in the Title Document.

2000019490	Kumar Ranjan Dharmendra, Rina Rai W/o Kumar Ranjan	27/06/2023 Rs. 25,67,917/- as on 08/07/2024	Rs. 15,50,000/-	Rs. 1,55,000/-
			 EL . M. D.	

Description of property: All that piece and parcels of Residential Land bearing Flat No. B-503, buildup area admeasuring 76.06 Sq. Mtrs., Super buildup admeasuring 1101 Sq. Ft. Scheme known as "SAI PARK", Situate at Revenue Survey No. 475, 476, 477 & 478, Block No. 177 of Moje Village; Sachin, Tal: & Sub Dist.; Churiyasi City Surat, Distt.- Surat, Gujrat With Common Amenities Written in Title Document. Property Bounded By: East: Flat No. 504, West: Adj. Internal Road, North: Adj. Building No. "A", South: Flat No. 502

Terms and condition:

The E-auction will take place through portal https://sarfaesi.auctiontiger.net on 30-Jul-2024 (E-Auction Date) After 2.00 PM with limited extension of 10 minutes each.

The Intending Purchasers / Bidders are required to deposit EMD amount either through RTGS / NEFT or by way of Demand Draft/RTGS/NEFT favouring the "HERO HOUSING FINANCE LTD." The EMD amount will be return to the unsuccessful bidders after conclusion of the E-auction. TERMS AND CONDITIONS OF THE E-AUCTION: (1) E-Auction is being held on "As is where is Basis" & "As is what is Basis" & "whatever there is Basis" & "Without recourse Basis" and will be conducted "online". (2) Bid increment amount shall be Rs.15,000/- (Rupees Fifteen Thousand Only). (3) The E-Auction will be conducted

through M/s E-Procurement Technologies Ltd. (Helpline No(s): 07961200576/ 544/ 594/ 596/ 531

583/ 569, 6351896643 and E-mail on support@auctiontiger.net/maulik.shrimali@auctiontiger.net) at their web portal https://sarfaesi.auctiontiger.net. (4) There is no encumbrance on the property which is in the knowledge of Secured Creditors. However, the intending bidders should make their own independent enquires regarding the rowerer, the mentioning blues is studio make their own independent enquires regarding the encumbrances, title of property put on auction and claims/ rights/ dues/ affecting the property, prior to submitting their bids. In this regard, the E-Auction advertisement does not constitute and will not be deemed to constitute ant commitment or any representation of Hero Housing Finance Limited. (5)The Authorized Officer / Secured Creditor shall not be responsible in any way for any third party claims/ rights/ dues. The sale shall be subject to rules/ conditions/ prescribed for any finird party claims/ rights/ dues. The sale shall be subject to rules/ conditions/ prescribed under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002. The other terms and conditions of the E-Auction are published in the following website: www.herohousingfinance.com (6) For property details and visit to property contact to Mr. Hari Rajawat / hari.rajawat@herofif.com / 982867777 (7) The prospective bidders can inspect the property on 23-Jul-2024 between 11.00 A.M and 2.00 P.M with prior appointment. 15 DAYS SALE NOTICE TO THE BORROWER/GUARANTOR/MORTGAGOR

The above mentioned Borrower/Mortgagor/Guarantors are hereby noticed to pay the sum as mentioned in Demand Notice under section 13(2) with as on date interest and expenses before the date of Auction failing which the property shall be auctioned and balance dues, if any, will be recovered with interest and cost from you.

For detailed terms and conditions of the sale, please refer to the link provided in https://uat.herohomefinance.in/hero_housing/other-notice on Hero Housing Finance Limited (Secured Creditor's) website i.e www.herohousingfinance.com

FOR HERO HOUSING FINANCE LIMITED AUTHORISED OFFICER Email: assetdisposal@herohfl.com PLACE: SURAT

HERO HOUSING FINANCE LIMITED Registered Office: 09, Community Centre, Basant Lok, Vasant Vihar, New Delhi-110057 Branch Office: Office 638-639, 6th Floor, Old Amarpali Cinema, Raiya Road, Rajkot.

PUBLIC NOTICE (E- AUCTION FOR SALE OF IMMOVABLE PROPERTY) [UNDER RULE 9(1) OF THE SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002] NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTY MORTGAGED WITH HERO HOUSING

FINANCE LIMITED (SECURED CREDITOR) UNDER THE SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST Notice is hereby given to the public in general and in particular to the borrower(s) and guarantor(s) o heir legal heirs/representatives that the below described immovable properties mortgaged/charged

their legal helps representatives that the below described minovable properties mortgageworthaged to the Secured Creditor, the possession of which has been taken by the Authorized Officer of Hero Housing Finance Limited (secured creditor), will be sold on 30-Jul-2024 (E-Auction Date) on "AS IS WHERE IS", "AS IS WHAT IS" and "WHATEVER THERE IS" basis for recovery of outstanding dues from below mentioned Borrowers, Co- Borrowers or Guarantors. The Reserve Price and the Earnes Money Deposit is mentioned below. The EMD should be made through Demand Draft/RTGS/NEF1 for participating in the Public E-Auction along with the Bid Form which shall be submitted to the Authorised Officer of the Hero Housing Finance Ltd On or before 29-Jul-2024 till 5 PM at Branch Office: Office 638-639, 6th Floor, Old Amarpali Cinema, Raiya Road, Rajkot.

Loan	Name of Borrower(s)/	Date of	Type of Possession (Under	Reserve
Account	Co- Borrower(s)/	Demand Notice		Price
No.	Guarantor(s)/ Legal Heir(s)/ Legal Rep.	Amount as on date	Constructive/ Physical)	Earnest Money
HHFRAJHOU21	Gajendra Singh	27/06/2023	Physical	Rs.
000014192 &	Rajkumra Singh Rajput,	Rs. 14.14.681/-		7,00,000/-
HHFRAJIPL210 00014197	Rachna Gajendra Singh Rajput, Ramavat Foramben Ashishbhai			Rs. 70,000/-

Description of property: All that piece and parcels of property bearing a Residential Flat No B-202 on second floor having built-up area admeasuring 38.61 Sq. Meters of Unit-B of Building namely "BALAJI FLATES" Constructed on the NA land area 1019.15 Sq. Meters of Plot no 222 to 233 & 405 to 407 of Revenue Survey No. 129 & 130 Pailki, of Village- Veraval, Sub-Dist. Kotda Sangani, Regi Dist. Of Rajkot which Ares known as Shantidham-2 and bounded as; Property Bounded By: North: Passage, then after Flat no B-201;South:Unit-C East:Road;West:Flat No.B-203

Terms and condition: The E-auction will take place through porta https://sarfaesi.auctiontiger.net on 30-Jul-2024 (E-Auction Date) After 2.00 PM with limited extension of 10 minutes each.

The Intending Purchasers / Bidders are required to deposit EMD amount either through RTGS / NEFT or by way of Demand Draft/RTGS/NEFT favouring the "HERO HOUSING FINANCE LTD." The EMD amount will be return to the unsuccessful bidders after conclusion of the E

Terms and Conditions of the E-Auction: 1.E-Auction is being held on "As is where is Basis" & "A is what is Basis" & "whatever there is Basis" & "Without recourse Basis" and will be conducte "online". Z.Bid increment amount shall be Rs. 15,000/- (Rupees Fifteen Thousand Only). 3. The E-Auction will be conducted through M/s E-Procurement Technologies Ltd. (Helpline No(s) 07961200576/544/594/596/531/583/569, 6351896643 and E-mail on support@auctiontiger.ne maulik.shrimali@auctiontiger.net) at their web portal https://sarfaesi.auctiontiger.net. 4. There is n encumbrance on the property which is in the knowledge of Secured Creditors. However, the intending bidders should make their own independent enquires regarding the encumbrances, title o property put on auction and claims/ rights/ dues/ affecting the property, prior to submitting their bids In this regard, the E-Auction advertisement does not constitute and will not be deemed to constitut ant commitment or any representation of Hero Housing Finance Limited. 5. The Authorized Officer. Secured Creditor shall not be responsible in any way for any third party claims/rights/ dues. The sale shall be subject to rules/ conditions/ prescribed under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002. The other terms and conditions of the E-Auction are published in the following website: www.herohousingfinance.com 6. For property details and visit to property contact to Mr. Hari Raiawat / hari raiawat@herohfl.com / 98286777727. The prospective bidders can inspect the property on 23-Jul-2024 between 11.00 A.M and 2.00 P.N

15 DAYS SALE NOTICE TO THE BORROWER/GUARANTOR/MORTGAGOR

The above mentioned Borrower/Mortgagor/guarantors are hereby noticed to pay the sum as mentioned in Demand Notice under section 13(2) with as on date interest and expenses before the date of Auction failing which the property shall be auctioned and balance dues, if any, will be ecovered with interest and cost from you.

For detailed terms and conditions of the sale, please refer to the link provided in https://uat.herohomefinance.in/hero_housing/other-notice on Hero Housing Finance Limited Secured Creditor's) website i.e www.herohousingfinance.com For Hero Housing Finance Ltd

Authorised officer Mr. Imran Mohammad Kureshi at Mob. No. 9974589783 Email:assetdisposal@herohfl.com

૧ હજાર હોટલ-રેસ્ટોરન્ટ બંધ

રાજકોટમાં અગ્નિકાંડ બાદ RMCની સીલ કરવાની કામગીરી સામે વિરોધ

શહેરમાં TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ મહાનગર પાલિકાએ હોટલ અને રેસ્ટોરન્ટ પાસે ફાયર NOC અને BU પરમિશન નથી તેને સીલ કરવાની કામગીરી શરૂ કરી છે. જેને કારણે અનેક લોકોના ધંધા રોજગારને અસર પહોંચી છે. આજે રાજકોટ હોટેલ સંચાલક એસોસિયેશન દ્વારા બંધ પાળવામાં આવ્યો છે. શહેરની એક હજાર જેટલી હોટેલ, રેસ્ટોરન્ટ, બેંક્વેટ હોલ, પાર્ટી પ્લોટ બંધ રાખવામાં આવ્યાં છે. તે ઉપરાંત રાજકોટ હોટલ સંચાલક એસોસિયેશનના પ્રમુખ મેહુલ પટેલે સીલ ખોલવા માટે ઇસ્ઝના અધિકારીએ રૂ. પુ અમીષાબેન હોવાનું તેમણે જણાવ્યું હતું. ફાયર ર્દઝ નથી, સ્ટ્રક્ચર મંજૂર નથી અને લાખની ખંડણી માંગી હોવાનો આક્ષેપ કર્યો આ વ્યક્તિ ઇસ્ઝમાં અરજી કરે છે અને કમ્પ્લીશન પણ નથી.

રાજકોટ હોટેલ સંચાલક એસોસિયેશનના પ્રમુખ મેહુલ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, આજે રાજકોટમાં એક હજાર જેટલી હોર્ટેલ, રેસ્ટોરન્ટ, બેંક્વેટ હોલ, પાર્ટી પ્લોટ બંધ રાખવામાં આવ્યાં છે. અત્યારે જ ફાયર એનઓસી અને મેં પરમિશન માગવામાં આવે છે. અત્યાર સુધીમાં ૬૦૦ જેટલી પ્રોપર્ટી સીલ કરવામાં આવી છે. જે પ્રોપર્ટી સીલ કરવામાં આવી છે ત્યાં રૂ. પ-પ લાખના હપ્તા માગવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકાના નામે એક અધિકારી રૂ. પ લાખના હપ્તા માગતા હતા. જેમનું નામ

તેના આવેદન બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સીલ મારવામાં આવે છે. મેહુલ પટેલે વધુમાં કહ્યું હતું કે, અમારી માગણી એ જ છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હોટેલ-રેસ્ટોરન્ટ સીલ કરવાની કામગીરી તાત્કાલિક બંધ કરવામાં આવે. અમે મ્યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઈ પાસે જઈએ તો અમને ૧૯૮૬નો કાયદો સમજાવે છે.જ્યારે હોટેલ-રેસ્ટોરન્ટના સીલ ખોલાવવા 3. પ લાખના હપ્તાના આક્ષેપ મામલે અમીષાંબેન વૈદ્યએ જણાવ્યું હતું કે, રૂ. પ લાખના આક્ષેપ કરવામાં આવ્યા તે ખોટા છે. સેકન્ડ વાઇફ અને ઢોસા ડોટ કોમ રેસ્ટોરન્ટ પાસે

સાબરડેરી દ્વારા પશુપાલકોને લઈ મોટો નિર્ણય

૨૫૮ કરોડ રુપિયા ભાવફેર રુપે પશુપાલકોને ચુકવાશે • સાબરકાંઠા , તા.૧૦ સ્થિતિમાં ખેડૂતો અને પશુપાલકોને માટે સુધીના ત્રેણ માસના રીટેન્શન મનીની રકમ

ભાવફેરને લઈ નિર્ણય કરતા વચગાળાના ગુરુવારથી દૂધ મંડળીઓને ચૂકવી આપવા આપવામાં આવશે. માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સાબરડેરી દ્વારા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ચારેક લાખ જેટલા પશુપાલકોને લઈ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. સાબરડેરીએ દૂધ ઉત્પાદકોના ભાવફેરને લઈ નિર્ણય કરતા વચગાળાના ધોરણે હાલમાં ૯ મહિનાનો ભાવફેર ગત કરવામાં આવેલ પરીપત્ર મુજબ સાબરડેરી વર્ષના મુજબે ચૂકવી આપવામાં આવશે. જે દ્વારા ૨૫૮ કરોડ રુપિયા ભાવફેર રુપે ગુરુવારથી દૂધ મંડળીઓને ચૂકવી આપવા પશુપાલકોને ચૂકવવામાં આવશે. માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જોઈ રહ્યા હતા. એક તરફ શૈક્ષણિક સત્ર ડિસેમ્બર ૨૦૨૩ સુધીના ૯ માસના આમ હવે ચેરમેન પદની ચૂંટણી યોજાવાની જૂન માસથી શરુ થયુ છે અને બીજી તરફ રીટેઈન મની ચૂકવવામાં આવનાર છે. રાહ જોવાઈ રહી છે. જે બાદ પશુપાલકોને ચોમાસુ વાવણીની શરુઆત થઈ છે. આવી જ્યારે જાન્યુઆરી ૨૦૨૪ થી માર્ચ અંત બાકીની વધુ રકમ મળશે.

સાબરડેરીએ દૂર્ઘ ઉત્પાદકોના આર્થિક સંકડોમણ અનુભવાતી હોય છે. અને આખા વર્ષની વાર્ષિક ચૂકવણીની રકમ વકેરને લઈ નિર્જાય કરતા વચગાળાના જેને લઈ હવે સાબરડેરીએ આ અંગે દૂધ પણ આવનારા સમયમાં ચૂકવવામાં આવશે. ધોરણે હાલમાં ૯ મહિનાનો ભાવફેર ગત ઉત્પાદકોના હિતમાં વચગાળાનો રસ્તો વર્ષના મુજબે ચૂકવી આપવામાં આવશે. જે નિકળતા ભાવફેર ૯ માસના ધોરણે ચૂકવી

> ભાવફેર અંગે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા, આ દરમિયાન જ હવે સાબરડેરીએ મહત્વનો નિર્ણય કર્યો છે. સાબરડેરીના મેનેજિંગ ડિરેક્ટરને આપવામાં આવેલી સત્તાની રુએ આ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાબરડેરીના એમડી દ્વારા જાહેર

દૂધ ઉત્પાદકો ભાવફેર અંગે રાહ કરવામાં આવેલ એપ્રિલ ૨૦૨૩ થી

ગત માર્ચ માસમાં સાબરડેરીની સામાન્ય ચૂંટણી યોજવામાં આવી હતી. દરમિયાન ડેરીના નિયામક મંડળના ૧૬ પૈકી ૧૫ ડિરેક્ટર બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે એક ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાઈ હતી. આમ સામાન્ય ચૂંટણી બાદ નવુ નિયામક મંડળ ચૂંટાઈ આવ્યું છે.

હવે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી માટે રાહ જોવામાં આવી રહી છે. હવે નવા ચેરમેનની નિમણૂંક થવા બાદ ભાવફેર અંગે આખા વર્ષની ચૂકવવાપાત્ર રકમની ચૂકવણી કરવામાં આવશે. જેમાં જૂના નિયામક મંડળ દ્વારા મંજૂર બાકીના ત્રેણ માસની રકમ અને સંપૂર્ણ વર્ષની વાર્ષિક ચૂકવણીની રકમ ચૂકવાશે.

રાજકોટ અગ્નિકાંડ મામલામાં સાગઠીયાની કબુલાત

TRP ગેમ ઝોનના સંચાલકો પાસેથી લાંચ લીધી હોવાનું સાગઠીયાએ કબુલ્યું

૨૭ - ૨૭ નિર્દોષ લોકોનો ભોગ પાછળ મુખ્યત્વે ભ્રષ્ટાચાર જ કારણભુત દ્વારા જાહેર કરાયા ન હતા. કરોડોની હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. એન્ટી કરપ્શન બ્યુરો સમક્ષ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાએ કબૂલ્યું છે કે તેણે સાગઠિયાએ આખરે કબૂલ્યું હતું કે તેણે મનસુખ સાગઠિયાએ અનેક પ્લાન પાસ કરી ભ્રષ્ટાચાર કર્યાનું પણ સ્વીકારી લીધું છે.

૨૦૨૧માં ટીઆરપી ગેમ ઝોન નાના પાયે શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદના વર્ષોમાં વધુને વધુ ગેરકાયદે બાંધકામ કરી તેને મોટા પ્રમાણમાં શરૂ કરવામાં આવ્યો હતો. જે-તે વખતે મનપાની ટીપી શાખાએ તેનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે નોટીસ આપી હતી. પરંતુ પછીથી કોઈ કાર્યવાહી કરી ન હતી.

લેવાયો હતો. તે સાથે જ ટીપીઓ મનસુખ સાગઠિયાએ ગેરકાયદે બાંધકામ કેમ તોડેયું ભલામણ તે બાબતે તર્ક-વિર્તકો થતા હતા. પણ ભ્રષ્ટાચારની જ હતી તેવો ખુલાસો નેતાઓને ઉની આંચ આવશે કે કેમ તે હજુ

નામ શું છે અગર તો લાંચ લીધી હતી તો એસીબીના અધિકારીઓએ વધુમાં જણાવ્યું અપ્રમાણસર મિલકતના ગુનામાં એસીબી પાસે ૬ દિવસના રિમાન્ડ પર રહેલા ટીઆરપી ગેમ ઝોનનું ગેરકાયદે બાંધકામ નિર્દોષ લોકોનો ભોગ ન લેવાત. એટલું જ નહીં એસીબી સમક્ષની સાગઠિયાની બીજી કબુલાતથી પણ સ્પષ્ટ થઈ ગયું છે કે તેણે મનપામાં મોટાપાયે, પેટભરીને કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો હતો.

જો કોઈ નેતાની ભલામણ હતી તો તેનું પણ એસીબીની તપાસ પરથી થયો છે. સુધી સૌથી મોટો સવાલ છે.

કેટલી તે બાબતેના કોઈ ખુલાસા અત્યાર 📑 સાગઠિયાએ કોની-કોની પાસેથી લાંચની લેનાર રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ સુધી થયા ન હતા કે પછી તપાસનીશો ૨કમ લીધી તેનો ખુલાસો કર્યો નથી અને તે બાબતેના હવે કોઈ પુરાવા મળશે કે કેમ તે પણ મોટો સવાલ છે. સાગઠિયાના કાર્યકાળ દરમિયાનની તમામ ફાઈલો એસીબીએ મંગાવી સાગઠિયા સાથે ભળેલા લાંચ લઈ ટીઆરપી ગેમ ઝોનનું ગેરકાયદે ટીઆરપી ગેમઝોનનું ગેરકાયદે બાંધકામ બિલ્ડરો અને આર્કિટેકટોની ઊંઘ હરામ બાંધકામ તોડયું ન હતું તેમ એસીંબીના એક લાંચ લઈને તોડયું ન હતું. જોકે તેણે આ થશે, નેતાઓને આંચ આવશે કે કેમ તે પ્રશ્ન અધિકારીએ નામ નહીં લખવાની શરતે માટે કેટલી લાંચ લીધી તે અંગે એસીબીના હજુ અનુત્તર રાજકોટ પૂર્વ ટીપીઓ મનસુખ જણાવ્યું હતું. સાથો-સાથ એમ પણ કહ્યું કે અધિકારીઓએ ખુલાસો કરવાનું હાલ સાગઠિયાએ ટાઉન પ્લાનીંગ શાખામાં રહી ટાળ્યું છે. એસીબીની તપાસમાં થયેલા આ કરોડોનો ભ્રષ્ટાચાર આચર્યાની એસીબી ખુલાસાથી સ્પષ્ટ થયું છે કે જો જે-તે વખતે જ સમક્ષ કબૂલાત આપતા જ એસીબીએ આ દિશામાં હવે તપાસ શરૂ કરી છે. જેના તોડી પાડવામાં આવ્યું હોત તો કદાચીત ૨૭ ભાગરૂપે સાગઠિયાએ તેના કાર્યકાળ દરમિયાન ખરેખર કેટલા પ્લાન (ફાઈલો) મંજુર કર્યા હતા, કેટલી ફાઈલોનો તાત્કાલીક નિકાલ કર્યો હતો, કેટલી ફાઈલો પેન્ડીંગ રાખી હતી, કેટલી ફાઈલો રિજેકટ કરી હતી તેની માહિતી એસીબીએ મનપાની એટલું જ નહીં તેના ભાઈની કચેરીમાંથી મંગાવી છે. આ ફાઈલો થોકબંધ આખરે આ ગેરકાયદે બંધાયેલા ઓફિસમાંથી એસીબીને ૧૫ કરોડની હોવાથી તે મળવામાં જ ચાર-પાંચ દિવસનો ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં કિંમતનું ૨૨ કિલો સોનું અને ૩ કરોડની સમય લાગી જશે. ત્યાર પછી આ તમામ બાળકો સહિત ૨૭ નિર્દોષ લોકોનો ભોગ રોકડ મળી કુલ રૂપિયા ૧૮ કરોડથી વધુની ફાઈલોનો એસીબી ઊંડાણપૂર્વક અભ્યાસ મત્તા મળી હતી, તે પણ ભ્રષ્ટાચારની કરી આગળની કાર્યવાહી કરશે. એસીબીની જ હોવાનું પણ સાગઠિયાએ કબૂલી આ કાર્યવાહીથી સાગઠિયા સાથે મળી ન હતું તેની પાછળના કારણો અંગે તરેહ- લીધું છે. એટલે કે સોનાના દાર્ગીના ભ્રષ્ટાચાર કરનાર બિલ્ડરો, આર્કીટેકટો તરેહની ચર્ચાઓ થતી હતી. આ માટે ભ્રષ્ટાચારની રકમમાંથી જ ખરીદવામાં વગેરેની મુશ્કેલીઓ વધે તેવી શકયતા ભ્રષ્ટાચાર કારણભુત હતો કે નેતાઓની આવ્યા હતા. જયોરે ૩ કરોડની રોકડ રકમ છે. જોકે સાંગઠિયા સાથે ભળેલા મનાતા

જામનગરમાં વિવિધ તાલુકામાં વરસાદ સાથે વીજળી પડતા ત્રણ લોકોનાં મોત

રાહત આપી છે તો વીજળી પડવાના લીધે આવી છે. ત્રણ જણાએ જીવ ગુમાવ્યા છે. મહિલા સહિત ત્રણના મોત થયા છે. જામનગર જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. દોઢિયા તાલુકામાં વીજળી પડવાથી ૧૮ વર્ષનો યુવક દાઝ્યો છે.

સાયક્લોનિક સરક્યુલેશનના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્રના અનેક તાલુકામાં ભારે વરસાદ પણ નોંધાયો છે.જામનગરજિલ્લામાં અલગ અલગ જગ્યાએ વીજળી પડતાં એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થવાથી તેઓનું અંતરિયાળ મૃત્યુ નીપજ્યું થયા છે. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત હતું. જામજોધપુરના મામલતદાર દ્વારા

જામનગર તાલુકામાં દોઢિયા ગામમાં ધરી છે. વીજળી પડવાથી એક- એક વ્યક્તિના

મોત નીપજ્યા છે. જ્યારે દોઢિયા ગામમાં નરમાણા ગામમાં પણ વરસાદી વીજળીએ જામનગરમાં વરસાદ સાથે વીજળી એક વ્યક્તિ વીજળી પડવાથી દાઝી છે. એક ખેડૂતનો ભોગ લીધો છે. નરમાણા પડતા ત્રણના મોત થયા છે. આમ વરસાદે 🛮 જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં 🐧 ગામમાં વાડી વિસ્તારમાં રહેતા અને ખેતી

ગામના એક ખેડૂત તેમજ નરમાણા સમયે એકાએક આકાશી વીજળી પડી ગામના એક ખેડૂત પર વીજળી પડવાથી હતી, અને ભડથું થવાના કારણે તેનું ઘટના બંનેના અંતરિયાળ મૃત્યુ નિપજ્યા છે. જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા કિરીટ સિંહ બચુભા ઝાલા નામના ૫૫ વર્ષના ખેડૂત કે જેઓ પોતાની વાડીમાં બપોરે ૪-૩૦ વાગ્યાના અરસામાં ખેતી કામ કરી રહ્યા હતા, જે દરમિયાન તેઓ ઉપર એકાએક મનિષાબેન નામની ૩૦ વર્ષ ની શ્રમિક વરસાદી વીજળી પડી હતી અને ભડથું આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં જામનગર જિલ્લાના જામજોધપુરના જામજોધપુર પોલીસે બનાવના સ્થળે

કામ કરતા દેવરખીભાઈ અરજણભાઈ જામજોધપુર તાલુકાના બુટાવદર ડાંગર નામના ખેડૂત યુવાન પર બપોરના સ્થળેજ મૃત્યુ નીપજ્યું હતું. જામજોધપુરના નાયબ મામલતદાર ચાલુ વરસાદે બનાવના સ્થળે નદી પાર કરીને પહોંચ્યા હતા, તેમજ પોલીસની મદદ લીધી છે.

જામનગર તાલુકાના દોઢીયા ગામમાં રહેતી અને ખેતી કામ કરી રહેલી યુવતી નું વીજળી પડવાથી દાજી જતાં સ્થળ પરંજ કરુણ મૃત્યુ નીપજયું છે. આ ઉપરાંત તેની સાથે ખેતી કામ કરી રહેલો અલ્પેશ નામનો ૧૮ વર્ષનો યુવક ગંભીર સ્વરૂપે દાજી ગયો હોવાથી તેંને સારવાર બુટાવદર, નરમાણા ગામમાં અને પહોંચી જઈ આગળની કાર્યવાહી હાથ માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પંચકોશી એ. આ ઉપરાંત જામજોધપુર તાલુકા ના ડિવિઝનનો પોલીસ કાફ્લો દોડતો થયો છે

સાબરડેરીએ પશુપાલકોને ૨૫૮ કરોડ ભાવફેર રકમ ચુકવણી કરાશે

● โอ๊ะหิดสาวาร, ๓. ๑๐

સાબરડેરી દ્વારા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ચારેક લાખ જેટલા પશુપાલકોને લઈ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. સાબરડેરીએ દૂધ ઉત્પાદકોના ભાવફેરને લઈ નિર્ણય કરતા વચગાળાના ધોરણે હાલમાં ૯ મહિનાનો ભાવફેર ગત વર્ષના મુજબે ચૂકવી આપવામાં આવશે. જે ગુરુવારથી દૂધ મંડળીઓને ચૂકવી આપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.

દૂધ ઉત્પાદકો ભાવફેર અંગે રાહ જોઈ રહ્યાં હતા. એક તરફ શૈક્ષણિક સત્ર જૂન માસથી શરુ થયુ છે અને બીજી તરફ ચોમાસુ વાવણીની શરુઆત થઈ છે. આવી સ્થિતિમાં ખેડૂતો અને પશુપાલકોને માટે આર્થિક સંકડામણ અનુભવાતી હોય છે. જેને લઈ હવે સાબરડેરીએ આ અંગે દૂધ ઉત્પાદકોના હિતમાં વચગાળાનો રસ્તો નિકળતા ભાવફેર ૯ માસના ધોરણે ચૂકવી આપવામાં આવશે.

ભાવફેર અંગે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા, આ દરમિયાન જ હવે સાબરડેરીએ મહત્વનો નિર્ણય કર્યો છે. સાબરડેરીના મેનેજિંગ ડિરેક્ટરને આપવામાં આવેલી સત્તાની રુએ આ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાબરડેરીના એમડી દ્વારા જાહેર કરવામાં આવેલ પરીપત્ર મુજબ સાબરડેરી દ્વારા ૨૫૮ કરોડ રુપિયા ભાવફેર રુપે પશુપાલકોને ચૂકવવામાં આવશે.

જુના નિયામક મંડળ દ્વારા મંજૂર કરવામાં આવેલ એપ્રિલ ૨૦૨૩ થી ડિસેમ્બર ૨૦૨૩ સુધીના ૯ માસના રીટેઈન મની ચૂકવવામાં આવનાર છે. જ્યારે જાન્યુઆરી ૨૦૨૪ થી માર્ચ અંત સુધીના ત્રણ માસના રીટેન્શન મનીની રકમ અને આખા વર્ષની વાર્ષિક ચૂકવણીની રકમ પણ આવનારા સમયમાં ચૂકવવામાં આવશે.

ગત માર્ચ માસમાં સાબરડેરીની સામાન્ય ચૂંટણી યોજવામાં આવી હતી. દરમિયાન ડેરીના નિયામક મંડળના ૧૬ પૈકી ૧૫ ડિરેક્ટર બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે એક ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાઈ હતી. આમ સામાન્ય ચૂંટણી બાદ નવુ નિયામક મંડળ ચૂંટાઈ આવ્યું છે.હવે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી માટે રાહ જોવામાં આવી રહી છે. હવે નવા ચેરમેનની નિમણૂંક થવા બાદ ભાવફેર અંગે આખા વર્ષની ચૂકવવાપાત્ર રકમની ચૂકવણી કરવામાં આવશે. જેમાં બાકીના ત્રણ માસની રકમ અને સંપૂર્ણ વર્ષની વાર્ષિક ચૂકવણીની રકમ ચૂકવાશે. આમ હવે ચેરમેન પદની ચૂંટણી યોજાવાની રાહ જોવાઈ રહી છે. જે બાદ પશુપાલકોને બાકીની વધુ રકમ મળશે.

ભચાઉ હત્યાના પ્રયાસમાં જામીન રદ થતાં લેડી કોન્સ્ટેબલ નીતા ચોધરી ફરાર

• ભુજ,તા.૧૦ સીઆઈડી ક્રાઈમ પૂર્વ કચ્છમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ નીતા વસરામભાઈ ચૌધરી બૂટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે ઝડપાઈ હતી. સફેંદ થારમાંથી દારૂ મળી આવવા સાથે પીએસઆઈ પર થાર ચડાવી હત્યાનો પ્રયાસ કરાયો હતો. બંને સામે ભચાઉ પોલીસમાં ફરિયાદ થયા બાદ પોલીસે રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરતાં રિમાન્ડ નકારી બીજા દિવસે નીતા ચોંધરીને નીચલી કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા.બાદમાં પોલીસે જામીનને રદ્દ કરવા ઉપલી કોર્ટમાં જતા જામીન રદ કરવામાં આવ્યા હતા અને હાલ પોલીસ ધરપકડથી બચવા અને જેલમાં જવાના ડરે આરોપી નેતા

આપતી વખતે એવું નોંધ્યું હતું . ચૌધરી ફરાર થઈ ગઈ છે અને તેમને પકડવા ત્રણ અલગ અલગ ધીમો બનાવવી હોવાનું પોલીસમાંથી જાણવા મળ્યું છે.તેમને નીચલી અદાલતમાંથી જામીન મળ્યા બાદ સેશન્સ અદાલતમાં સુનાવણી યોજવામાં આવી હતી. જેમાં સરકાર પક્ષે ગુનાની ગંભીરતા તેમજ પોતે પોલીસ કર્મચારી હોવા છતાં બૂટલેગરને સાથ આપ્યો તે સહિતના મુદ્દાઓ રજૂ કર્યા બાદ સેશન્સ અદાલતે બંને પક્ષની દલિલો સાંભળી

ભચાઉની નીચલી અદાલતે આપેલો જામીનનો હુકમ રદ કરી જામીન ફગાવ્યા છે.સરકાર પક્ષે દલિલ કરવામાં આવી હતી કે, મહિલા કોન્સ્ટેબલ હોવા છતાં પ્રથમ ફરજ પોલીસને સાથ આપવાની હોય તેમ છતાં બનાવ સમયે પોલીસ પર ગાડી ચડાવી દેવાઈ તેમ છતાં આરોપીને પકડાવ્યો નહીં તેમજ ગાડીમાંથી દારૂ મળી આવ્યો હતો. આરોપી બૂટલેગર ૧૬ ગુનામાં લિસ્ટેડ છે, જેથી ભૂમિકા શંકાસ્પદ જણાય છે.જે તે સમયે નીચલી અદાલતે જામીન

<u>શુદ્ધિપત્ર</u>

શુદ્ધિપત્ર નંબર : 1 ટેન્ડર નંબર : CPM-GSENGG-BRC-02-24-25 (ઓપન ટેન્ડર) છેલ્લી તારીખ / સમય 07/08/2024 15:00 **કામનું** નામ : વડોદરા વિભાગ: વડોદરા - ગેરતપ વિભાગ પર કિમી 471/16-18 ખાતે એલસી નંબર 294 ની જગ્યાએ એપ્રોચ રોડ સહિત રોડ ઓવર બ્રિજ (ROB) નું બાંધકામ.સંશો**ધિત વસ્તુઓ** ક્ષેત્રનું નામ ટેન્ડર બંધ થવાની તારીખ સમય હાલનું મૂલ્ય : 23/07/2024 15:00 સંશોધિત મૂલ્ય : 07/08/2024 15:00 બિડિંગની શેરૂઆતની તારીખ : હાલનું મૂલ્ય : 09/07/2024 સંશોધિત મૂલ્ય : 24/07/2024

મળે લાશક કરોઃ 🚹 facebook.com/WesternRly

WESTERN RAILWAY - VADODARA DIVISION INTERVIEW OF PART TIME DENTAL SURGEON ON CONTRACT BASIS VADODARA DIVISION (WR)

Part Time Dental Surgeon on Contract basis (for four

Railway Hospital, Pratpanagar, Vadodara. In view of above, Divisional Railway Hospital Pratapnagar Vadodra (WR) will be conducting a WALK- IN-INTERVIEW for filling up the posts of Part Time Dental Surgeon for four hours per day and six days in a week Details of the Post, Age limit, Remuneration and Date of interview as under

١	Sr. No	Category	Total Vacancy	sc	ST	ОВС	UR	EWS	Age as on issue of date of notification	011111110	Date of Interview
	1	Part Time Dental Surgeon	01	00	00	00	01	00	Less than 53 years	₹36900/-	18-07-202- (Thursday)

II) Age Relaxation: 5 years for SC/ST and 3 years for OBC as per extant rules. Visit:- www.wr.indianrailways.gov.in for more details of notification and term and

CONTACT ADDRESS: AUDITORIUM DIVISIONAL RAILWAY HOSPITAL WESTERN

એશ્ટેલ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ

રજી. ઓફીસ : વડોદરા – હાલોલ હાઈવે, બાસ્કા,પંચમહાલ-૩૮૯૩૫૦, ગુજરાત **ફોન:** (02676) 247900 ย์भेต : info@axtelindia.com, **वेબसार्थर :** www. www.axtelindia.com, CIN: L91110GJ1991PLC016185

नोटीस

આથી નોટીસ આપવામાં આવે છે કે ૩૨મી વાર્ષિક સામાન્ય સભા તારીખ ઓગસ્ટ ૧, ૨૦૨૪ ગુરૂવાર ૧૧:૦૦ વાગ્યના રોજ વીડીયો કોન્ફરેન્સીંગ (વીસી) / અન્ય ઓડીયો વિઝુઅલ (ઓએવીએમ) માધ્યમથી યોજેલ છે, જેમાં જુન ૨૭, ૨૦૨૪ ની નોટીસમાં નિર્ધારિત કાર્ચો કરવામાં આવશે. MCA દ્વારા તાર્જેતર જાહેર કરાચેલા સામાન્ય પરિપત્ર સપ્ટેમ્બર ૨૫, ૨૦૨૩ અને અગાઉ જારી કરાયેલા પરિપત્રો ડીસેમ્બર ૨૮, ૨૦૨૨, મે ૫, ૨૦૨૨, જાન્યુઆરી ૧૩, ૨૦૨૧, મે ૫,૨૦૨૦, એપ્રીલ ૮,૨૦૨૦ અને એપ્રીલ ૧૩,૨૦૨૦ તથા સેબી(SEBI) ધ્વારા તાજેતરમાં જાહેર કરાચેલા સામાન્ય પરિપત્રો, ઓકટોબર ૬,૨૦૨૩ અને અગાઉના પરિપત્રો જાન્યુઆરી ૫, ૨૦૨૩ તા. મે ૧૩, ૨૦૨૨, જાન્યુઆરી ૧૫,૨૦૨૧, મે, ૧૨, ૨૦૨૦ સાથેના સામુહિક પણે ના વાચન સાથે સેબી ના રેગ્યુલેશન ૪૪ (લિસ્ટીંગ ઓબ્લીગેશન એન્ડ ડીસ્કલોઝર રિકાયરમેન્ટસ) અને વિનિયમો ૨૦૧૫ ની જોગવાઈના અનુપાલન માં, કંપની ની વાર્ષિક સામાન્ય સભા વીસી/ઓએવીએમ મારફતે યોજવામાં આવશે. કંપનીએ ગુજરાતી અને અંગ્રેજી અખબારમાં તા. જુલાઈ ૪, ૨૦૨૪ ના રોજ સભાસદોને વિનંતી કરવામાં આવી હતી કે તેમના KYC કંપની

જુલાઇ ૧૦, ૨૦૨૪ના રોજ નોટીસ સાથે વર્ષ ૨૦૨૩-૨૪ ના વાર્ષિક એઠવાલ જેમના ઈ.મેઈલ સરનામા કંપની /ડીપોઝીટરી ભાગીદાર/૨૭૨ટ્રાર તથા શેર ટ્રાન્સફર એજેન્ટ સાથે નોંધાયેવેલા છે તેમને કંપની ના રજસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજેન્ટ લીંક ઈનટાઈમ ઈન્ડીયા પ્રા. લી., (એલઆઈઆઈપીએલ) ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યા છે.

કંપનીઝ એક્ટ, ૨૦૧૩ની કલમ ૯૧ મુજબ અને લાગુ પડતા નિયમો અનુસાર નોટીસ આપવામાં આવે છે કે કંપનીના સભાસદોનું ૨જીસ્ટર તથા શેર ટ્રાન્સફર બુક્સ તા. જુલાઇ ૨૫, ૨૦૨૪ ગુરુવાર થી તા. ઓગસ્ટ ૧, ૨૦૨૪ ગુરૂવાર સુધી (સંકલિત બે ૅરિવસ) વાર્ષિક સામાન્ય સભા હેતુસર બંધ રાખવામાં આવશે.

કંપનીઝ એક્ટ, ૨૦૧૩ની કલમ ૧૦૮ અને લાગુ પકતા નિયમો દેઠળ જોગવાઈ અનુસાર વાર્ષિક સામાન્ય સભા ની નોટીસ તથા સંપૂર્ણ વાર્ષિક એહવાલ ૨૦૨૩-૨૪ તથા ઈ-વોટીંગ ની સુચના કંપની ની વેબસાઈટ www.axtelindia.com ઉપર ઉપલબ્ધ છે જે સભાસદો ડાઉનલોડ કરી શકે છે. કંપની તેમના સભ્યોને ઈલેક્ટ્રોનિક રીતે મત આપવાની સુવિધા આપેલ છે જેમાં રીમોટ ઈ-વોટીંગ નો સમયગાળો સોમવાર જુલાઇ ૨૯,૨૦૨૪ના રોજ સવારે ૯:૦૦ વાગે શરૂ થશે અને બુધવાર જુલાઈ ૩૧, ૨૦૨૪ સાંજે ૫:૦૦ વાગે સમાપ્ત થશે. કોઈ પણ વ્યક્તિ, જે કટ ઓફ તારીખ એટલે કે બુધવાર જુલાઇ ૨૪, ૨૦૨૪ના ના રોજ કંપનીના શેર ધરાવતા હશે, તે રીમોટ ઈ-વોટીંગ સુવિધાનો ઉપયોગ કરીને તમામ ઠરાવો પર મત આપવા માટે પાત્ર છે. રિમોટ ઈ-વોર્ટીંગ સુવિધાને જણાવેલ તારીખ અને સમયની બહાર મંજુરી આપવામાં આવશે નહી.

સભાસદો ઇ-મતદાન માટેની પૂછપરછ કે પ્રશ્નો www.evotingindia.com ની વેબસાઇટ પર વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) અને ઇ-મતદાન માટેનું મેન્યુલ પર જોઇ શકેછે https://instavote.linkintime.co.in અથવા enotices@linkintime.co.in પર ઈ. મેઈલ લખી શકે છે.

વોટીંગ ની સુચના કંપની ની વેબસાઈટ www.axtelindia.com ઉપર ઉપલબ્ધ છે જે સભાસદો ડાઉનલોડ કરી શકે છે., બોર્ડના હૂફમથી એશ્ટેલ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ. વતી

સ્થળ : નુરપુરા

વાર્ષિક સામાન્ય સભા ની નોટીસ તથા સંપૂર્ણ વાર્ષિક એહવાલ ૨૦૨૩-૨૪ તથા ઈ-

પ્રેરણા બોકીલ કંપની સેક્રેટરી

ગુજરાતમાં નકલી દસ્તાવેજ કૌભાંડ વચ્ચે ડાંગ જિલ્લામાં પણ નકલી જમીન દસ્તાવેજ કૌભાંડ સામે આવ્યું

ગુજરાતમાં નકલી દસ્તાવેજ કૌભાંડ વચ્ચે ડાંગ જિલ્લામાં પણ નકલી જમીન દસ્તાવેજ કૌભાંડ સામે આવ્યો છે. જી હાપ હાલ થોડા સમય પહેલા દાહોદ જિલ્લામાં એનએ થયેલી જમીનો ખરીદવાના વિવાદમાં હાઇકોર્ટ સામેના કેસમાં અરજદારે કોર્ટ સમક્ષ કેટલીક હકીકતો મૂકી હતી ત્યારે ફરી આવીજ એક ઘટના ડાંગમાં બની છે. આપને જણાવી દઈએ આદિવાસી ૭૩એએ જમીન માં ટેન્ટ હાઉસ બનાવી બનાવટી દસ્તાવેજો બનાવી છેતરપિંડી કરવામાં આવી છે.જેના કારણે આહવા તાલુકાના બારીપાડા ગામે સર્વે નં ૧૨૧ વાળી જમીનને બિનખેતી અંગે બનાવટી દસ્તાવેજો નીકળતા મહેસુલ વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે સાપુતારા પોલીસ મથકે સર્કલ ઓફિસરે સરકારી ખોટા દસ્તાવેજો બનાવવા મુદ્દે પ ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે.માહિતી અનુસાર સાપુતારા પોલીસેતપાસ હાથ ધરતા આદિવાસી જમીનોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વો માં ફફડાટ ફેલાયો છે ત્યારે આ પહેલા આવી ઘટના દાહોદમાં બની હતી જ્યાં દાહોદ જિલ્લામાં એનએ થયેલી જમીનો ખરીદવાના વિવાદમાં હાઇકોર્ટ સામેના કેસમાં અરજદારે કોર્ટ

સમક્ષ કેટલીક હકીકતો મૂકી હતી. વેબસાઇટ પર મૂકાયેલી વિગતો અને સિટી સર્વેના પ્રોપર્ટી કાર્ડ ચકાસ્યા પછી સંલગ્ન જમીનો એનએ થયેલી હોઈ ખરીદી હતી. હવે સ્થાનિક મામલતદાર છે.તેવામાં રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ નોટિસ આપીને કહે છે કે તમે ખેડૂત ન હોવા છતાં ગુજરાત ગણોત વહીવટી નકલી કૌભાંડનો પર્દાફાશ થતા હડકંપ અને ખેતીની જમીન અધિનિયમ ૧૯૪૮ મચી જવા પામ્યો છે.ડાંગ જિલ્લાનાં મુજબની જરૂરી મંજૂરીઓ મેળવ્યા વગર ખેતીની જમીન તબ્દીલ કરી જમીન ધરાવો છો. ફક્ત એટલું જ નહીં મામલતદારો અરજદારોને મામલતદાર, કલેક્ટર કે ટ્રિબ્યુનલ સમક્ષની કાર્યવાહીમાં વકીલ રોકવાની પણ મનાઈ ફરમાવી હતી. કોઈ અભણ,અંધ અને અશક્ત જ વકીલ રોકી શકે તેમ જણાવ્યું હતું.હાઇકોર્ટે જણાવ્યું હતું કે સરકારના રેકોર્ડ પર જમીન એનએ થર્યેલી બતાવે છે તો પછી તમે કયા આધારે અરજદારને નોટિસ ફટકારી, જો જમીન એનએ થયેલી નથી તો પછી વાસ્તવમાં સરકારી અધિકારીઓ સામે કાર્યવાહી

ડાંગ જિલ્લાનાં બારીપાડા ગામ ખાતે સનરાઈઝ રેસ્ટોરન્ટ અને રિસોર્ટનાં સંચાલકોએ કલેક્ટર ઓફીસ ડાંગનાં સંચાલક મહેશભાઈ દામુભાઈ પવાર દ્વારા નામનો બિનખેતીની જમીનનો નકલી

થવી જોઈએ.

હુકમ બનાવી તંત્રને છેતરવાનો પ્રયાસ અરજદારોએ પોતે સીટી સર્વેની કરતા પાંચ ઈસમો સામે ગુનો નોંધાયો. વીઓ રાજ્યમાં નકલીની બોલબાલા વચ્ચે નકલી અધિકારીઓ અને નકલી સરકારી કચેરીઓ ઝડપાઈ ચુકી જિલ્લામાં પણ બિનખેતીની જમીન માટેનું આહવા તાલુકાનાં બારીપાડા ગામ ખાતે નિર્માણ થઈ રહેલ સનરાઈઝ રેસ્ટોરન્ટ અને રિસોર્ટનાં સંચાલકોએ જમીનની બિનખેતી માટેની પરવાનગી લેવા અંગે કોઈ પણ અરજી કરવામાં આવી ન હતી. તેમ છતાં પણ તેઓએ કલેકટર ઓફીસ ડાંગ દ્વારા બિનખેતીની પરવાનગી આપી દેવામાં આવેલ હોય તેવો બનાવટી હુકુમ બનાવી મામલતદાર સમક્ષ રજુ કર્યો હતો. જોકે અહી બોગસ હુકુમ રજૂ કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવતાની સાથે જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તપાસ શરૂ કરી હતી.જેમાં સર્વે નં.૧૨૧ વાળી જમીન પૈકી ૧૨૦૦ ચો.મી જમીન બિનખેતીનો મંજુ૨ થયેલ હોવાનો હુકમ સનરાઈઝ રેસ્ટરોન્ટ અને રિસોર્ટનાં બતાવવામાં આવ્યો હતો.

જૂનાગઢના માણાવદરનો ખારો ડેમ થયો ઓવરફ્લો, નિચાણવાળા ગામોને એલર્ટ

હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાએ જુનાગઢ સહિતના જિલ્લાઓમાં ધબધબાટી બોલાવી છે. ત્યારે જૂનાગઢના માણાવદરનો ખારો ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા નિચાણવાળા ગામોને ચેતવણી આપવામાં આવી છે. જેમાં ભલગામ, કોડવાવ, રેવદ્રા, અક્લેરા, સામેગા ગામોમાં એલર્ટ કરવામાં આવ્યા છે.

વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની ચોક, આઝાદ ચોક, બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં વરસાદે જમાવટ કરી.તો બીજી તરફ જૂનાગઢ શહેરમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો છે.

આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આગામી ૨ દિવસ દક્ષિણ ગુજરાત અને ગઈકાલે ૬ દિવસના વિરામ બાદ સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ દ્વારકા,મોરબી,જામનગર,રાજકોટમાંભારે જૂનાગઢ શહેર અને વંથલી પંથકમાં ફરી આપવામાં આવ્યું છે. જ્યારે મધ્ય ગુજરાત વરસાદની આગાહી કરવામાં આવી છે.

ધોધમાર વરસાદથી વંથલીના પટેલ આગાહી કરવામાં આવી છે. સુરત ,ડાંગ ,નવસારી ,વલસાડ ,તાપીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત જુનાગઢ ,અમરેલી ,ભાવનગર ,ગીર સોમનાથમાં પણ અતિભારે હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. જ્યારે બનાસકાંઠા ,પાટણ ,મહેસાણા ,સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ ,મહીસાગર ,દીવ, કચ્છ,

ડાચામાઇન્સ એન્ડ કેમીકલ્સ લિમિટેડ

CIN NO: L24110GJ1976PLC002905

Diamines રજીસ્ટર્ડ ઓફિસ : પ્લોટ નં. ૧૩, પીસીસી એરિયા, પી.ઓ. પેટ્રોકેમિકલ્સ, વડોદરા - ૩૯૧૩૫૦.

૪૮મી વાર્ષિક સામાન્ય સભાની રીવાઈઝડ સૂચના, ઈ-મતદાન માહિતી અને બુક ક્લોઝર

આથી રીવાઇઝડ સૂચના આપવામાં આવે છે કે ડાચામાઇન્સ એન્ડ કેમીકલ્સ લિમિટેડ ('કંપની') ની ૪૮મી રીશીડચુલ્ડ વાર્ષિક સામાન્ય સંભા (એજીએમ) પ્લોટ નં. ૧૩, પીસીસી એરિયા, પી.ઓ. પેટ્રોકેમિકલ્સ, વડોદરા - ૩૯૧૩પ૦ ખાતે ગુરૂવાર, ઓગષ્ટ ૦૧, ૨૦૨૪, સવારે ૧૧:૦૦ વાગ્ચે, જુલાઇ ૦૯, ૨૦૨૪ ના રોજ એજીએમની રીવાઇઝડ નોટિસ ('નોટિસ') માં નક્કી કરાચેલા સામાન્ય અને ખાસ વ્યવસાચોને પાર કરવા માટે કંપનીની રજિસ્ટર્ક ઑફિસમાં રાખવામાં આવેલ છે. પ્રોક્સી ફોર્મ સાથેની નોટિસ, એટેન્ડન્સ સ્લિપ, ઇ-મતદાન સંચાર અને વાર્ષિક અહેવાલ ઑડિટેડ નાણાંકીય નિવેદનો (એકલા અને એકીકૃત) સાથે મળીને બધા સભ્યોને કુરિયર / પોસ્ટ થી તેમના રજીસ્ટર્ડ સરનામે અને જેમણે કંપની / કિપોઝીટરી પાર્ટિસિપન્ટ સાથે તેમના ઇ-મેલ સરનામાં નોંધાવ્યા છે તેમને ઇલેક્ટ્રોનિકલી રીતે જુન ૨૯, ૨૦૨૪ ના રોજ મોકલવામાં આવ્યા છે. ઉપરોક્ત રીવાઇઝડ નોટિસ, અન્ય દસ્તાવેજો કંપનીની વેબસાઇટ www.dacl.co.in પર ઉપલબ્ધ છે અને લીંક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (LIIPL) ની વેબસાઇટ https://instavote.linkintime.co.in પર પણ ઉપલબ્ધ છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટેની ૪૮મી એજીએમની રીવાઇઝડ નોટિસ મોકલવાની કામગીરી જુલાઇ ૧૦, ૨૦૨૪ ના રોજ પૂર્ણ થઇ છે.

કંપની એક્ટ, ૨૦૧૩ ની કલમ ૧૦૮ મુજબ, કંપની (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) નિયમો, ૨૦૧૪ ના નિયમ ૨૦ અને સેબી (લિસ્ટિંગ ઓબ્લીગેશન અને ડિસ્કલોઝર રિક્વાચરમેન્ટ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ ની નિયમન ૪૪ સાથે વાંચી, કંપની તેના સભ્યોને ઇલેક્ટ્રોનિક માધ્યમથી લીંક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (LIIPL) દ્વારા ઇ-મતદાન સેવાઓ દ્વારા ૪૮મી એજીએમની રીવાઇઝડ નોટિસમાં સેટ કરવામાં આવેલા તમામ રિઍલ્યુશન પર મતદાન કરવા માટે ઈ-મતદાન સુવિદ્યા પ્રદાન કરે છે. જુલાઈ ૨૫, ૨૦૨૪ ના કટ-ઑફ તારીખના આઘારે શેર ભૌતિક સ્વ કિમટીરિયલાઇર્ઝ્ડ સ્વરૂપમાં ઘરાવતા હોય તો, ૪૮મી એજીએમની નોટિસમાં રજૂ કરેલા તમામ ઠરાવો પર ઇલેક્ટ્રોનિક રીતે મત આપી શકે છે.

તમામ સભ્યોને આથી જાણ કરવામાં આવે છે કે :

રીમોટ ઇ-મતદાન

- એ.જી.એમ. નોટિસમાં નક્કી કરાયેલા સામાન્ય અને ખાસ વ્યવસાયને LIIPL દ્વારા પૂરી પાડવામાં આવેલ ઈ-મતદાન સેવા (ઈલેક્ટ્રોનિક માધ્યમો) મારફતે પણ વ્યવહાર કરવામાં આવશે.
- સભ્યોને ઇ-મતદાનની પ્રક્રિયા અને રીત વિશે તારીખ જુલાઇ ૦૯, ૨૦૨૪ ની એજીએમ નોટિસના ભાગ રૂપે નોટ્સનો સંદર્ભ લેવા વિનંતી કરવામાં આવે છે.
- એજીએમમાં રીમોટ ઇ-મતદાન દ્વારા મતદાનની ચોગ્યતા નક્કી કરવા માટેની **કટ-ઑફ તારીખ જુલાઇ ૨૫,** ૨૦૨૪ છે.
- રીમોટ ઇ-મતદાન **રવિવાર, જુલાઇ ૨૮, ૨૦૨૪ (ભારતીય સમય મુજબ સવારે ૯:૦૦ વાગ્યાથી) શરૂ થશે અને બુદાવાર, જુલાઇ ૩૧, ૨૦૨૪ (ભારતીય સમય મુજબ સાંજે પ:ં૦૦વાગ્યે) સમાપ્ત થશે.** આ સમયગાળા દરમિયાન, સભ્યો તેમના મત ઇલેક્ટ્રોનિક રીતે આપી શકે છે. ઇ-મતદાન મોડચુલ પછીથી LIIPL દ્વારા નિષ્કિય કરવામાં આવશે. સભ્યોના મતદાન અધિકારો **જુલાઇ ૨૫, ૨૦૨૪ ('કટ-ઑફ તારીખ')** મુજબના ઈક્વિટી શેરના પ્રમાણમાં હશે. કોઇપણ વ્યક્તિ જે કટ-ઑફ તારીખ પર કંપનીનો સભ્ય છે તે એજીએમની નોટિસમાં રજૂ કરેલા તમામ ઠરાવો પર મત આપવા માટે પાત્ર છે.
- મતદાન દ્વારા મતદાનની સુવિધા એજીએમમાં પૂરી પાડવામાં આવશે. મીટિંગમાં હાજરી આપનારા સભ્યો અને જેઓએ મતદાન પહેલાં ઇ-મતદાન કર્યું ના હોય, તેઓ બેઠકમાં મતદાન કરી શકશે.
- રીમોટ ઈ-મતદાન દ્વારા મત આપવાનો અધિકારનો ઉપયોગ કર્યા પછી પણ સભ્ય એજીએમમાં ભાગ લઇ શકે છે પરંતુ મીટિંગમાં ફરીથી મત આપવા માટે મંજૂરી આપવામાં આવશે નહીં.
- મીટિંગમાં હાજરી આપવા અને મત આપવા માટેના ઉમેદવાર પોતે, હાજરી આપવા અને મત આપવા માટે પ્રોક્સી નિયુક્ત કરવા માટે અધિકૃત છે અને પ્રોક્સીને સભ્ય બનવાની જરૂર નથી. પ્રોક્સીની નિયુક્તિ કરનાર ફોર્મ, મીટિંગ શરૂં થતાના અડતાલીસ કલાક પહેલા કંપનીની રજસ્ટર્ડ ઓફિસમાં જમા કરાવવાનું રહેશે.
- કોઈપણ વ્યક્તિ, જે એજીએમની નોટિસ મોકલ્યા બાદ કંપનીના શેર મેળવે છે અને કટ-ઑફ તારીખ જુલાઈ ૨૫, ૨૦૨૪ ના રોજ સભ્ય દશે તેઓ enotices@linkintime.co.in પર વિનંતી મોકલીને લૉગ-ઇન આઇડી અને પાસવર્ડ મેળવી શકે છે. જો કોઇ વ્યક્તિ ઇ-મતદાન માટે LIIPL સાથે પહેલાથી જ નોંધાચેલ હોચ તો મત આપવા માટે હાલના યુઝર આઇડી અને પાસવર્ડનો ઉપયોગ કરી શકે છે.
- શેરહોલ્ડરોને ઇ-મતદાન અંગે કોઇ પ્રશ્નો અથવા સમસ્યા હોય તો તેઓ, enotices@linkintime.co.in પર વિનંતી મોકલીને લીંક ઇનટાઇમ ઇન્ટાવોટ 'સહાચ વિભાગ'નો સંદર્ભ લઇ શકે છે અથવા ફોન નંબર ૦૨૨ -૪૯૧૮૬૦૦૦ પર સંપર્ક કરી શકે છે. મેમ્બર્સ કંપનીના કંપની સેક્રેટરીને <u>secretarial@dacl.co.in</u> અથવા કંપનીની રજિસ્ટર્ડ ઑફિસ પર પણ લખી શકે છે.

- કંપની એક્ટ, ૨૦૧૩ ના સેક્શન ૯૧ અને સેબી (લિસ્ટિંગ ઓબ્લીગેશન અને કિસ્ક્લોઝર રિક્વાચરમેન્ટ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ ના નિયમ ૪૨ અનુસાર, નોટિસ પણ આપવામાં આવે છે, કંપનીના રજિસ્ટર અને શેર ટ્રાન્સફર બુક્સ **જુલાઇ ૨૬, ૨૦૨૪** થી **ઓંગષ્ટ ૦૧, ૨૦૨૪** (બંને દિવસ સહિત), ૪૮મી એજીએમના હેતુ માટે અને અંતિમ ડિવિંડંડની ચુકવણી માટે (જો એજીએમના સભ્યો દ્વારા મંજૂર કરવામાં આવે તો) બંધ રહેશે.
- સભ્યોને તેમના તમામ પત્રવ્યવહારને ૨જીસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ લીંક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, "ગીતાકુંજ", ૧, ભક્તિનગર સોસાયટી, એબીએસ ટાવર્સની પાછળ, જુના પાદરા રોડ, વડોદરા -૩૯૦૦૧૫, શ્રી અલ્પેશ ગાંઘી, ઇ-મેલ <u>vadodara@linkintime.co.in</u> અને ફોન નંબર ૦૨૬૫ - ૩૫૬૬૭૬૮ ઉપર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.

ફાઈનાન્સ એકટ-૨૦૨૦ની જોગવાઈઓને અનુસરીને શેરધારકોને મળતી ડિવિડન્ડની આવકને તારીખ એપ્રિલ ૦૧. ૨૦૨૦ થી કરપાત્ર ગણવામાં આવી છે અને જો જે૮મી વાર્ષિક સાધારણ સભામાં શેરધારકો મંજુર કરશે તો, કંપની દ્વારા પ્રવર્તમાન ઠરાવેલા દરો પ્રમાણે ચુકવવામાં આવેલા ડિવિડન્ડમાંથી સ્ત્રોત પર કરકપાત કરવાની રહેશે. વિવિધ શ્રેણીઓને લાગુ પડતા કરકપાતના દરોની જાણકારી માટે શેરધારકોને ફાઈનાન્સ એકટ - ૨૦૨૦ તથા તેને આનુષાંગિક સુધારાનો અભ્યાસ કરવા વિનંતી છે. શેરધારકોને તેમના પાન ની વિગતો કંપનીના રજસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ પાસે (શેર ભૌતિક રીતે ધારણ કરતા હોય તેવા કિસ્સામાં) અને સંબંધિત ડિપોજીટરી પાર્ટીસીપેન્ટ પાસે (જો શેર ડિમેટ મોડમાં હોય તો) તારીખ જુલાઇ ૧૫, ૨૦૨૪ ના રોજ અથવા તે પહેલાં સુધારો કરાવી લેવા વિનંતી છે. જો તેમના પાનની નોંઘણી નહીં થઈ હોય તો સ્ત્રોત પર કપાત ૨૦% ના ઉચા દરે કરવામાં આવશે. જો નિવાસી વ્યક્તિ શેરઘાક તરીકે પાન ઘરાવતો હોચ અને તે આવકવેરો ચુકવવાને પાત્ર ન હોચ તો તેણે સ્થળ પર કર કપાતમાંથી મુકિત માટે ફોર્મ નં. ૧૫ એચ 🖊 ૧૫ જી માં વાર્ષિક જાહેરાત કરવીં અને બિન નિવાસી શેરધારકો ભારત અને તેમના નિવાસના દેશ વચ્ચેના કર કરાર પ્રમાણે લાભદાચક કર દરનો લાભ લઈ શકે છે. એના માટે તેમણે તેમનો પરમેનન્ટ એસ્ટાબ્લીશમેન્ટ એન્ડ બેનિફીશીચલ ઓનરશીપ ડિકલરેશન, ટેકસ રેસીડેન્સી સર્ટીફીકેટ, ફોર્મ - ૧૦ એફ અને અન્ય જરૂરી દસ્તાવેજો રજુ કરવા પડશે. તેની વિગતો કંપનીની વેબસાઈટ <u>www.dacl.co.in</u> અને આરટીએની સાઈટ <u>www.linkintime.co.in</u> પર ઉપલબ્ધ છે.

> બોર્ડના હુકમથી, ડાચામાઇન્સ એન્ડ કેમીકલ્સ લિમિટેડ વતી, હેમાક્ષી પવાર કંપની સેક્રેટરી

મેમ્બરશીપ નં. Aપરપ૮૧

સ્થળ : વકોદરા dl. 90-09-2028 તારીખ : જુલાઇ ૧૦, ૨૦૨૪